

30 એપ્રિલ 2018

મૂડીરોકાણ બ્રેમ્પટનના આર્થિક વિકાસને માર્ગ કરી આપે છે

બ્રેમ્પટન, ઓન્ટારિયો – બ્રેમ્પટનને 2017માં બાંધકામ પ્રવૃત્તિથી \$1.4 મિલિયન કરતા વધારે લાભ થયો જેમાં નવું બાંધકામ તેમ જ વિસ્તરણ એમ બન્ને સામેલ છે. વિકાસ પ્રવૃત્તિઓ અને શહેરમાં ગતિમાન થઈ રહેલ અન્ય પહેલોના પરિણામે બ્રેમ્પટનમાં વધુ નોકરીઓ ઊભી થઈ છે અને મૂડીરોકાણ થયું છે.

આ અઠવાડિયે સીટી ઓફ બ્રેમ્પટન બ્રેમ્પટન ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચર રિવ્યુ 2017 જારી કરશે. આ દસ્તાવેજ જે છાપેલો તેમ જ [ઓનલાઇન](#) ઉપલબ્ધ છે તે 2017ની સફળતાઓ અને 2018માં તથા આગળના વિકાસની વ્યુહરચનાને પ્રકાશિત કરે છે. તે સીટીના ચાવીરૂપ આર્થિક ક્ષેત્રોમાં સાંસ્કૃતિક સીમાચિહ્નો અને પ્રવૃત્તિઓ દર્શાવે છે જેમાં નોંધપાત્ર વિકાસ પરિયોજનાઓથી લઈને સ્થાનિક સાહસિકોના પ્રોફાઇલ્સ જેઓ વ્યાપારના વિશ્વમાં નામ કરી રહ્યા છે તેનું ચિત્રણ છે.

"આ વિતેલા વર્ષે મજબૂત ભાગીદારીની રચના થઈ હતી, મહત્વની પહેલોએ આકાર લીધો હતો." એવું મેયર લિન્ડા જેફ્રીએ જણાવ્યું હતું. "બ્રેમ્પટનના સંખ્યાબંધ વ્યાપારોએ લગભગ છ ટકા જેટલી વૃદ્ધિ કરી હતી – જે આપણા GTAના અનેક પાડોશીઓ કરતા વધુ છે. આપણી વસ્તીમાં વધારો, યુવાન લોકો, જીવન ગુણવત્તા અને વિવિધતા બ્રેમ્પટનને વ્યાપારોને રોકાણ કરવા માટેનું અને પરિવારોને પ્રગતિ કરવા માટેનું જોરદાર સ્થળ બનાવે છે."

કાઉન્સિલર જેફ બોમ્બેને કહ્યું હતું કે "બ્રેમ્પટન પરિવર્તન માટે બિલકુલ તૈયાર પરિસ્થિતિમાં છે" જેઓ ઇકોનોમિક ડેવેલપમેન્ટ એન્ડ કલ્ચરના અધ્યક્ષ છે. "હાલમાં ઇકોનોમિક ડેવેલપમેન્ટ માસ્ટર પ્લાન અને કલ્ચર માસ્ટર પ્લાન વિકસાધિન છે તેમજ ન્યુ બ્રેમ્પટન 2040 વિઝન – તમામ મહત્વના પ્રોજેક્ટ્સ જે સાંસ્કૃતિક ગતિશીલતાના વિકાસ અને આર્થિક વિકાસને પ્રોત્સાહિત કરે, એવું બ્રેમ્પટન ઘડવું જે રોકાણ અને ઇનોવેશનનું હબ બની રહે."

આ માસ્ટર પ્લાન્સ વ્યુહાત્મક માર્ગનકશાઓ જેવા છેજે સ્પષ્ટ દિશા ચીંધે અને સીટીની અંદર ભાવિ ભાગીદારીઓ અને આર્થિક વિકાસને ટેકો આપતા પગલાં, બિઝનેસનાં સમુદાય, કલા અને સંસ્કૃતિના અ સમુદાય અને તેની પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓનો પરિચય કરાવે.

2017માં બ્રેમ્પટન સીટી કાઉન્સિલે નવી STEM (એટલેકે વિજ્ઞાન, ટેકનોલોજી, ઇજનેરી અને ગણિત) પર ધ્યાન કેન્દ્રિત કરતા વિશ્વવિદ્યાલય અને સેન્ટર ઓફ ઇનોવેશનની સ્થાપના કેનેડાની બે અગ્રેસર પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓ, રાયેરસન અને શેરિડાન કોલેજ સાથે મળીને કરવા માટે \$150 મિલિયનની પ્રતિબદ્ધતા દર્શાવી હતી.

એમેઝોનના દ્વિતિય મુખ્યાલય માટે બ્રેમ્પટનની બિડ એટલેકે બોલી જે ટોરોન્ટો ગ્લોબલ સાથેની ભાગીદારીમાં રજૂ કરવામાં આવી તે એમેઝોનની અંતિમ સૂચિમાં દેખાઈ હતી.

નવા પીલ મેમોરિયલ સેન્ટરનો તબક્કો 1, તે 2017માં પૂર્ન થયો હતો. એરિનોઆકકિડ્સ સેન્ટર ફોર ટ્રિટમેન્ટ એન્ડ ડેવેલપમેન્ટનો પ્રારંભ આ વર્સંત ઋતુમાં થયો જે સ્થાનિક અને પ્રાદેશિક બાળકો અને યુવાન લોકો માટેનું આરોગ્ય કાળજીમાં થયેલ \$60 મિલિયનના રોકાણનું પ્રતિનિધિત્વ કરે છે.

મેયર જેફ્રી જણાવે છે કે "આ ઉત્સાહપ્રેરક સમય છે" "બ્રેમ્પટન સફળ ભવિષ્ય અને મજબૂત આર્થિક વિકાસ માટે તૈયાર છે."

2017 મુખ્ય મુદ્દાઓની સમીક્ષા

- પ્રાદેશિક બેરોજગારીનો દરમાં ઘટાડો ચાલુ જ છે, જે ડિસેમ્બર 2016માં 7.1 ટકા હતો તે ઘટીને 2017માં 5.7 ટકા થયો.
- 2017માં કુલ બાંધકામ મૂલ્યમાં બ્રેમ્પટનનો ક્રમાંક દેશમાં 10મો હતો, જેને કારણે \$1.4 બિલિયન કરતા વધુ મૂડીરોકાણ થયું.
- રહેઠાણના બાંધકામ 2017માં કુલ \$1 બિલિયનની કિંમતના થયા જે આશરે 3,000 નિવાસોના એકમો થયા ગણાય.
- બ્રેમ્પટન 63,000 કરતા વધુ વ્યાપારોનું યજમાન છે જેમાં 280 એવા છે જે 100 કરતા વધુ લોકોને રોજગાર પૂરો પાડે છે
- 2017માં નવા કમર્શિઅલ બાંધકામોએ કમર્શિઅલ ઈન્વેન્ટરીમાં 4,10,000 ચોરસ ફુટ ફ્લોર સ્પેસ ઉમેરી. 28 રિટેઇલ ડેવેલપમેન્ટ્સએ બાંધકામ શરૂ કર્યું.
- બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર દ્વારા યોજાત સેમિનારો અને પ્રસંગોમાં 4,500 જેટલા સાહસિકોએ ભાગ લીધો હતો.
- બ્રેમ્પટન આંત્રપ્રુન્યોર સેન્ટર દ્વારા બ્રેમ્પટનના સાહસિકોને પ્રાંતીય નીધિયન તરીકે \$1,55,000 ની માતબર રકમ આપવામાં આવી હતી.
- બ્રેમ્પટનમાં થયેલ 505 પર્ફોર્મિંગ આર્ટ ઈવેન્ટ્સમાં 2,75,653 લોકો હાજર રહ્યા હતાં.
- 13 ફેસ્ટિવલ્સ અને ખાસ ઈવેન્ટ્સમાં 5,95,516 લોકો સહભાગી થયા હતા.

-30-

બ્રેમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કેનેડાના ઈનોવેશન સૂપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રેમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](#) અને [Facebook](#) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.

મિડિયા સંપર્ક (MEDIA CONTACT):

નેટલી સ્ટોગિલ (Natalie Stogdill)

મિડિયા સંકલનકર્તા (Media Coordinator)

સીટી ઓફ બ્રેમ્પટન (City of Brampton)

905.874.3654 | natalie.stogdill@brampton.ca